

To,
The Corporate Relations Department
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai – 400 001

Stovec Industries Ltd.

Regd. Office and Factory :

N.I.D.C., Near Lambha Village, Post Narol,
Ahmedabad - 382 405, INDIA

CIN : L45200GJ1973PLC050790

Telephone : +91 79 61572300
+91 79 25710407 to 410

Fax : +91 79 25710406

E-mail : admin@stovec.com

Reference : Scrip Code- 504959

Date : March 22, 2024

Subject : News Paper Advertisement for public notice for 50th Annual General Meeting (AGM) of the Company through Video Conferencing/Other Audio-Visual Means (VC /OAVM)

Dear Sir/Madam,

Pursuant to the Regulations 30 and 47 of SEBI (LODR) Regulations, 2015 read with circulars dated September 25, 2023 and May 05, 2020 issued by the Ministry of Corporate Affairs (MCA Circulars), we enclose herewith a copy of public notice published today in Business Standard (English) and JAI HIND (Gujarati) having electronic editions, intimating the Members about the 50th AGM of the Company to be held on Thursday, April 25, 2024 at 3:00 p.m. through VC/OAVM and other details as required by the MCA Circulars.

The same shall also be uploaded on the Company's website.

Kindly take the same on your record.

Thanking you,

Yours sincerely,
For **Stovec Industries Limited**,

Sanjeev Singh Sengar
Company Secretary & Compliance Officer

Encl.: As above

PUBLIC NOTICE That our Client/s is willing to Purchase the Immovable Property situated at Mauje Tarsali, Vadodara on land bearing R.S. no. 121, total area admeasuring 13051 Sq. Mtrs., Known as "Vithal Park Society", Paiki Sub - Plot no. 14 - J, Plot area admeasuring 105.11 Sq. Mtrs., Common area admeasuring 56.89 Sq. Mtrs., total area admeasuring 162.00 Sq. Mtrs., Built up area admeasuring 63.43 Sq. Mtrs., Super Built up area admeasuring 17.19 Sq. Mtrs., at Registration Sub - District & District Vadodara, from its Present owner Dipali Rahul More. That the said Property was previously owned by Yogesh Gangadhar Jagtap through a Sale Deed Vides Registration No. 5571, dated 20.09.2021 (27.09.2021). That the said Original Sale Deed along with its Registration Receipt is found to be missing. Therefore if any individual, Bank, Society, Institution or Financial Institution has its rights, charge, encumbrances, or lien, by any means; on the said property, then within 7 days from the publication of the notice may send their objections along with the Supportive Evidence. If not sent within given period of time, then my client will initiate further proceedings.

407-408, 4th Floor, Bluechip Complex, Nr. Stock Exchange, Sayajigunj, Sayajigunj, Vadodara - 5
Mo. - 9426396324

TEREDESAI ASSOCIATES
SAPAN TEREDESAI (ADVOCATE)

THE ASKA COOPERATIVE SUGAR INDUSTRIES LTD.
P.O. Nuagam (Aska) - 761111, Ganjam District, Odisha
Ph.No.06822-273464, 273465, 273737, Fax: 06822-273023
email:askasugar@yahoo.co.in, GSTIN : 21AAAT5989L1Z0

CANCELLATION OF QUOTATION CALL NOTICE

L.No.(PUR) 1256 Date : 21.02.2024
TheAska Cooperative Sugar Industries Ltd., at Nuagam, Aska
Quotation Call Notice No.(PUR).1882, Dt.15.02.2024, No.1881,
Dt.15.02.2024. For detail please visit our website
www.askasugar.com Managing Director

PUBLIC NOTICE
Notice is hereby given that the Certificate(s) for the under mentioned Equity Shares of the Company have been lost / misplaced and the holder(s) / purchaser(s) of the said Equity Shares have applied to the Company to issue duplicate Share Certificate(s).
Any person who has a claim in respect of the said Shares should lodge the same with the Company at its Registered Office within 21 days from this date else the Company will proceed to issue duplicate certificate(s) to the aforesaid applicants without any further intimation.

Folio No.	Name of Shareholder	No of Shares	Distinctive Nos. From To	Certificate No. From To
006156	FARSHED PATEL	500	33880426 33880925	956 956
006156	FARSHED PATEL	500	69651501 69652000	114521 114521
006153	THIRTY POONAWALA	500	33878261 33879225	953 953
006153	THIRTY POONAWALA	500	69650501 69651000	114519 114519

Name of the Shareholder
FARSHED BURJOR PATELL
THIRTY RUSI POONAWALLA
Date: 22/03/2024
Name of the Company: **SYMPHONY LIMITED**
Registered Address of the Company: "Symphony House", Third Floor, FP-12, TP-50, Off. S.G. Highway, Bodakdev, Ahmedabad, Gujarat, 380 059

Bank of Baroda
Regional Office, Surendranagar Region.
Phone : 02752-350019/22

SHIFTING OF BARWALA BRANCH PREMISES TO ALTERNATE PREMISES
KIND ATTENTION TO OUR MOST VALUED CUSTOMERS

By virtue of this notice, all customers of Bank of Baroda, Barwala Branch (Sol Id 9115) are hereby informed that the branch will be relocated to its New Premises situated at Behind New Post office, Tower Chowk, Barwala, Dist. Botad, Pin- 382 450 latest by 22.04.2024.

Customers are therefore requested to please visit the New Place of business for their banking need on shifting of the Branch Premises.
We sincerely regret the inconvenience caused to you in this regard and assure you of our best services at all times.

Regional Head, Bank of Baroda, Surendranagar Region

ELITECON INTERNATIONAL LIMITED
Registered and Corporate Office: 152, Shivani Apartments, Plot No. 63, I.P. Extension, Patparganj, East Delhi, Delhi-110092
CIN: L16000DL1987PLC396234, Telephone No.: +91-9871761020
Website: https://eliteconinternational.com/, Email-ID: admin@eliteconinternational.com

SHORTER NOTICE OF EXTRA-ORDINARY GENERAL MEETING, E-VOTING AND BOOK CLOSURE

Shorter notice is hereby given that the Extra-Ordinary General Meeting ("EGM") of the Members of ELITECON INTERNATIONAL LIMITED ("the Company") is scheduled to be held on Friday, March 29, 2024 at 04:00 P.M. at the registered office of the Company at 152, Shivani Apartments, Plot No. 63, I.P. Extension, Patparganj, Delhi-110092 to transact the businesses as set out in Notice convening the EGM of the Company.

The dispatch of the notice of EGM, inter alia indicating the process and manner of remote e-voting, along with attendance slip and proxy form, has been completed on March 20, 2024, to the Members whose names appear in the Register of Members/List of beneficiaries received from the depositories in the following manner:

- Through email to the Members who have registered their email ID;
- Through post to other Members who have not registered their email ID.

In terms of Section 108 of the Companies Act, 2013 (the "Act") read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended, and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (the "Listing Regulations") and Secretarial Standard on General Meetings (SS2) issued by the Institute of Company Secretaries of India, the Company is providing the facility to its Members to exercise their right to vote by electronic means on any or all of the businesses specified in the Notice convening the EGM of the Company (remote e-voting), through e-voting services of Central Depository Services (India) Limited ("CDSL"). The details pursuant to the Act and Rules made thereunder are as under:

- Members holding shares either in physical form or in dematerialized form and whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories, as on the cut-off date, i.e. March 22, 2024 ("eligible Members"), shall be entitled to exercise their right to vote by remote e-voting as well as voting to be held at EGM on any or all of the businesses specified in the Notice convening the EGM of the Company;
- the remote e-voting will commence on Tuesday, March 26, 2024 at 09:00 a.m.;
- the remote e-voting will end on Thursday, March 28, 2024 at 5:00 p.m.;
- the remote e-voting module shall be disabled for voting thereafter and voting through electronic means shall not be allowed thereafter. Once the vote on a resolution is cast by a Member, the Member shall not be allowed to change it subsequently;
- Members may note that:
 - the facility for voting through ballot paper shall be made available at the EGM and the members attending the meeting who have not casted their vote by remote e-voting shall be able to exercise their rights at the meeting through ballot paper;
 - A member may participate in the EGM even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote at the EGM.
- In case a person has become a Member of the Company after the dispatch of the EGM Notice but on or before the cut-off date-i.e. March 22, 2024, may obtain the login ID and password by sending request at helpdesk.evoting@cdslindia.com.
- A person, whose name is recorded in the register of Members or in the register of Beneficial owners maintained by the depositories as on cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the EGM through ballot paper.
- In case of any queries, you may refer to Frequently Asked Questions (FAQs) for members and e-voting user manual for members available at the Download sections of http://www.evoting.com or contact Mr. Vipin Sharma, Managing Director at kjc002828@yahoo.in.
- The Board of Directors has appointed Mr. Aakash Goel, Practicing Company Secretary as a Scrutinizer to scrutinize the voting through Remote e-voting and Insta Poll process in a fair and transparent manner.
- The Register of members and Share Transfer Books of the Company will remain closed from Saturday, March 23, 2024 to Friday, March 29, 2024 (both days inclusive) for the purpose of EGM.

Members may go through the Notice for the EGM for detailed process and manner on remote e-voting. Any grievances or queries of the Members of the Company, connected with the electronic voting, can be addressed to as per the details provided above.

The Notice convening the EGM and other relevant documents will be available on the website of the Company at www.eliteconinternational.com and the website of CDSL at www.evotingindia.com.

By order of the Board
For Elitecon International Limited
Sd/-
(VIPIN SHARMA)
MANAGING DIRECTOR

Date: 21.03.2024
Place: New Delhi

STOVEC INDUSTRIES LIMITED
Regd. Office: N.I.D.C., Nr. Lambha Village, Post: Narol, Ahmedabad, Gujarat - 382405.
Tel: +91 (0) 79 6157 2300, Fax: +91 (0) 79 2571 0406,
E-mail: secretarial@stovec.com, CIN : L45200GJ1973PLC050790, Website: www.stovec.com.

NOTICE OF 50th ANNUAL GENERAL MEETING

NOTICE is hereby given that the 50th Annual General Meeting ("AGM") of Stovec Industries Limited ("the Company") will be held on Thursday, 25th April, 2024 at 3.00 p.m. through video conferencing/other audio-visual means (VC/OAVM) in accordance with the provision of the Companies Act, 2013 ("the Act") and rules made thereunder read with General Circular No. 09/2023 dated September 25, 2023 which permitted companies to hold their AGM through VC/OAVM following the procedures as prescribed under MCA Circular No. 20/2020 dated May 05, 2020 (collectively referred as "MCA Circulars") without the physical presence of the members. In compliance of MCA Circulars and the relevant provisions of the Act, the 50th AGM of the members of the Company will be held through VC/OAVM to transact the businesses as set forth in the Notice of said AGM.

Full Annual Report of the Company for the year 2023 including notice of AGM ("Annual Report") will be sent electronically through email to all the members whose e-mail addresses are registered with the Company/Depositories. Members are requested to please refer the detailed instructions for joining the AGM and manner of casting remote e-voting or e-voting during the AGM given in the notice of the AGM. Said Annual Report shall also be available on the website of the Company at www.stovec.com and the Stock Exchange at www.bseindia.com. Members attending the meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under the law.

Manner of registering/updating e-mail address and Bank Account:

- Members holding shares in physical mode, who wish to register or update their e-mail address and/or bank account with the Company, are requested to register/update the same by providing necessary details in KYC Form ISR-1 available on the website of the Company along with supporting documents/details as may be required, writing to our Registrar and Share Transfer Agent i.e. Link Intime India Private Ltd at 5th Floor, 506 to 508, Amarnath Business Centre - 1 (ABC-1), Beside Gala Business Centre, Nr. St. Xavier's College Corner, Off C G Road, Ellisbridge, Ahmedabad-380006. E-mail: ahmedabad@linkintime.co.in
- Members holding shares in demat mode can register/update their e-mail address and/or bank account with their depository participant(s) where demat accounts are maintained.

The above information is being issued for the benefit of all members of the Company in compliance of MCA Circulars. Members are requested to carefully read the instructions given in the notice of convening AGM for updating their individual details, joining AGM, and manner of casting votes through remote e-voting or voting during the AGM.

By Order of the Board of Directors
For Stovec Industries Limited,
Sd/-
Sanjeev Singh Sengar
Company Secretary
Membership No. FCS 7835

Place : Ahmedabad
Date : March 21, 2024

FOR THE IMMEDIATE ATTENTION OF PUBLIC SHAREHOLDERS OF SURYA FUN CITY LIMITED ("SFCL")
CIN: L74999CH1993PLC013306
Registered Office: SCO-1086-87, Sector 22-B, Chandigarh-160022
Tel. No.: 0172-2709539

This Public Announcement ("PA") is being issued by Mr. Kamaljit Singh S/o Sh Gurbax Singh R/o # 14-A, Sector -9, Chandigarh-160009 Managing Director of Surya Fun City Limited ("SFCL" or "Company") on his own and on behalf of other promoter namely Mr. Sarabjit Singh S/o Sh Gurbax Singh R/o House No. 116, Dayanand Nagar, Lawrence Road, Amritsar (as consented by other shares holders in promoter group), (hereinafter referred to as "Offeror"), pursuant to order dated 05.01.2024 passed by the Delisting Committee of BSE Ltd. ("Exchange") conveyed to Company vide its letter reference no. LIST/COMP/MR/532028/2456/2023-24 dated January 8, 2024.

SFCL was listed on the BSE Ltd. All listed equity shares of the Company have been compulsorily delisted from the platform of the Exchange w.e.f. 10th January, 2024 by BSE Ltd. in exercise of powers vested with the Committee under Regulation 22(2) of the Securities And Exchange Board of India (Delisting of Equity Shares) Regulations, 2009 (as amended from time to time) ("Delisting Regulations").

As per Delisting Regulations the Exchange had appointed independent Valuer for calculating the fair value of the equity share of the Company. As communicated by the Exchange vide letter ref. no. LIST/COMP/AS/3204/2023-24 dated February 02, 2024 the fair value reported by the independent valuer is Rs. 143.77 per equity shares of Rs. 10/- face value.

In view of the above and other considerations, the Offering Promoter have decided to offer exit to the Public Shareholders of SFCL/Company at price of Rs. 143.77 per Equity Share (which is as per the fair value per Equity Share as determined by the Independent Valuer appointed by the Exchange) ["Exit Price"] and Public Shareholders are here by invited to tender their fully paid up equity shares of Rs. 10/- each as per scheduled below

Date of Commencement of the Tendering Period: Saturday, March 23, 2024 Date of Expiry of the Tendering Period: **Monday, April 08, 2024**

As on the date of this PA, the paid up equity share capital of SFCL stood at 47,39,291 equity shares fully paid up of face value of Rs.10/- each, comprising of 26,50,900 equity shares held by the Promoters and 20,88,391 equity shares held by the Public Shareholders

Assuming full acceptances of this Offer, the Offering Promoters have requisite funds to honour the Exit offer. The Offering Promoters shall dispatch "Exit Application Form" (Form) along with Offer Letter to all the Public Shareholders at their registered address. The shareholders holders holding shares in physical form are requested to send the Exit Application Form, Transfer deeds duly executed and signed along with original share certificates and other self attested documents i.e. PAN card copy, address proof, identity proof and attested signatures from the bank, clearly marking the envelop "SURYA FUN CITY LIMITED - EXIT OFFER" to the Registrar Kind Attn. Mr. Anuj Rana M/s Skyline Financial Services Pvt. Ltd, having its registered office at D-153-A, 1st Floor, Okhla Industrial Area, Phase-I, New Delhi-110020 Phone No. 011-40450193-97). The shareholders holding shares in demat form should mention so in the Exit Application Form and transfer the shares into the Escrow Demat Account (held by in the name as Surya Fun City Limited Exit Offer) as mentioned in the Exit Application Form. Upon receipt of documents, complete in all respects / credit of shares in the said Escrow Demat account, the Offeror shall acquire the offered / tendered equity shares at the Exit Price of Rs. 143.77 per equity share for cash consideration.

However, those public shareholders who would not be able offer their shares under this Offers with in the tendering period, may do so within a period of one year i.e. on or before 22.03.2025 at the same price of Rs. 143.77 per equity share (please note that no interest shall be paid on the consideration amount).

The Promoters shall certify to the satisfaction of the BSE Ltd., the Designated Stock Exchange, that appropriate procedure has been followed for providing exit to the Public Shareholders.

In case of any queries regarding the Exit Offer, the Shareholders can contact Registrar of the Company Kind. Attn. Mr. Anuj Rana, M/s Skyline Financial Services Pvt. Ltd. at D-153-A, 1st Floor, Okhla Industrial Area, Phase-I, New Delhi-110020, Phone no. 011-40450193-97.

For SURYA FUN CITY LIMITED
Sd/-
Kamaljit Singh Place

Date: 21.03.2024
Place: Chandigarh

PUBLIC NOTICE
Notice is hereby given to all suppliers who supply manufactured goods and/or services to us and are micro, small and medium enterprises. Such suppliers may approach within 7 days of publication of this advertisement along with their self certified copy of updated udym registration certificate...stesallitd limited, 25-26, 35, 42-43, 44, 114, dic, industrial area, plot no.1, surajmaira, labana, baddi, distt solan, H.P.- 173205 and/or 530,531,532 ecotech-III, udyog kendra-II, greater noida-201306 (purchase@stesallitd.com)

SUMAN O. RAJPUT **NEHA H. KORADIYA**
ADVOCATE ADVOCATE
Office : 403, Shubham Complex, Shop No. 8, 9, 10, Haridarshan Complex, Por Mahallo, Nr. Anand Hospital, 135, Kubernagar-1, Katargam Darwaja, Nampura, Surat. M.9879816360. Surat-4. M.No. 9909090222

NOTICE - LOSS OF SHARE CERTIFICATE

This is to notify the shareholders and the general public that the original share certificate of company RHI MAGNESITA INDIA LTD, bearing folio no. 11109, Certificate no. 123, and comprising 2000 shares, registered in the name of Mr. Lal Shirishbhai Pandya has been reported lost. The person having possession of the same is requested to return it to the rightful owner or contact the company's registered office : Sky Line Financial Services Pvt. Ltd. D-153-A, 1st Floor, Okhla Industrial Area, Phase-I, New Delhi-110020. PH.: 011-26812682-83, 40450193-97, website : www.skylinertna.com and Transfer (RTA) within the next 15 days.

TENDER CARE — Advertoiral

GUJARAT REFINERY HANDS OVER MACHINE-HOLE CLEANING ROBOT TO DABHOI NAGARPALIKA UNDER CSR

Demonstrating the core value of Care, IndianOil Gujarat Refinery handed over a Solar Operated Machine-hole Sewage Cleaning Robot to Dabhoi Nagarpalika of Vadodara District under CSR. The solar-powered battery-operated all-terrain machine-hole cleaning robot is specially designed for sewage manhole cleaning.

The Machine-hole Sewage Cleaning Robot was flagged-off by Mr. Rahul Prashant, ED&RH, Gujarat Refinery in presence of Mr. Hitesh Shah, ED (T), CGMs, GMS, CSR team, officials of Gujarat CSR Authority and Dabhoi Nagarpalika.

Speaking on the occasion, Mr. Rahul Prashant, ED&RH shared that the machine-hole robot is a technological alternative to manual scavenging. The use of the robot ensures that there is no harm to the workers as it is the robot which enters the sewage hole. So there is no danger of inhaling poisonous gases and also the equipment enables quick, better cleaning and monitoring. Above all, the use of the machine-hole cleaning robot upholds human safety and dignity, said Mr. Rahul Prashant.

GACL HOSTS SECTORAL WORKSHOP ON BEST PRACTICES IN ENERGY EFFICIENCY IN CHLOR-ALKALI SECTOR

Under the UK-India Technical Assistance Programme on "Accelerating Smart Power and Renewable Energy" (ASPIRE), the Foreign Commonwealth and Development Office (FCDO), Government of UK in partnership with the Bureau of Energy Efficiency, Ministry of Power, Government of India, organised a sectoral workshop on "Best Practices in Energy Efficiency in Chlor-Alkali Sector: A Path for Decarbonization" on 27/02/24 which was hosted by Gujarat Alkalies and Chemicals Limited (GACL) at its Dahej complex.

The workshop covered various aspects such as the PAT scheme, CCTS, the Indian Carbon Market, new emerging technologies, etc. During the workshop, the stakeholders deliberated on best practices, technologies, and policy interventions required to accelerate the decarbonisation of the Chlor-Alkali sector, which is not only energy intensive but energy sensitive as well.

Addressing the participants virtually, Shri Swaroop P. IAS, the Managing Director of GACL, stated, "Our pursuit of excellence in the field of Energy Efficiency & Decarbonisation reflects the commitment of our management, motivated employees, and Energy Consultants, who have helped us achieve the best Specific Energy Consumption (SEC) index ever recorded by any unit in the Chlor-Alkali Sector. I am also proud to share that our commitment and efforts have been truly acknowledged through the award of 'The Top Performer Designated Consumer for PAT Cycle II' under the Chlor-Alkali sector in 2023 by BEE, Ministry of Power, Govt. of India. For years, GACL has remained a trendsetter in the industry and is committed to remaining so in the future."

GUJARAT GAS LIMITED (GGL) OFFERING AN INDUSTRY FIRST ALTERNATE FUEL PRICE LINKED GAS PRICING FOR THE BENEFIT OF THE WORLD'S LARGEST CERAMIC CLUSTER

●Gujarat Gas Limited (GGL), the largest City Gas Distribution (CGD) Company in India, has always pioneered in providing customer centric solutions over the past 3 decades. Through the innovative solutions, GGL has led from the forefront in making "Natural Gas a preferred fuel for Industrial use"

●GGL has published a first of its kind "Expression of Interest" (EOI) wherein the pricing methodology of natural gas is being linked to alternate fuel viz. Propane. This shall make natural gas more affordable. On the upper side, the natural gas price shall almost be at par with alternate fuel. Proposed Pricing Methodology addresses major risk faced by ceramic industry on account of frequent variations in fuel prices.

BANK OF MAHARASHTRA ORGANIZES ALL INDIA HINDI SEMINAR

An All India Hindi Seminar on 'Future Banking' was organized by Bank of Maharashtra for all the Banks, Financial Institutions and Insurance Companies across the country at Delhi. Ms. Anshuli Arya, IAS, Secretary, Department of Official Language, Ministry of Home Affairs, Government of India was present as the chief guest in this seminar. Shri Ashesh Pandey, Executive Director, Bank of Maharashtra presided over the function. Ms. Chitra Datar, General Manager, Shri K. Rajesh Kumar, General Manager, HRM and Rajbhasha, Shri Hari Shankar Vats, Zonal Manager, Delhi Zone and Dr. Rajendra Shrivastava, Deputy General Manager (Rajbhasha), Bank of Maharashtra were prominently present in the seminar.

Shri Jagjeet Kumar, Director and Shri Dharmir, Dy. Director, Department of Financial Services, Ministry of Finance were present in the seminar as a special guest. A large number of top executives and Hindi Officers of all the banks, financial institutions and insurance companies participated in the seminar.

Ms. Anshuli Arya, IAS in her address said that the banks and financial institutions are the backbone of economy of the country. She said that banks are also implementing the government schemes through banking services. Shri K. Rajesh Kumar, General Manager, HRM and Rajbhasha welcomed all the participants. Sessions and panel discussion on "Future Banking" were conducted in the seminar. Inauguration of Bank's In House Magazine "Mahabank Pragati" and its Braille version were released by the dignitaries present on the stage. On this occasion various Hindi Mobile Apps of the bank were also launched. The winners of the All India Hindi Essay Competition organized by the Bank of Maharashtra were also awarded on the occasion.

In his address Shri Ashesh Pandey, Executive Director said that it is indeed very interesting to imagine the future of banking in the days to come. We have come a long way from traditional branch banking to internet banking, mobile banking and conversational banking. Banks and institutions can adapt their products to the expectations of the market and the new generation of customers by adopting the latest technologies like AI, cloud computing and language. Shri Ashesh Pandey said that Hindi and regional languages are powerful mediums to convey our ideas and our schemes to far-flung areas. Shri Hari Shankar Vats, Zonal Manager, Delhi Zone proposed a vote of thanks.

HDFC BANK **HDFC Bank Ltd.** **POSSESSION NOTICE**

Branch : HDFC Bank Limited, Trident, Race Course, Vadodara-390007. Tel : 079-64807999

Whereas the Authorised Officer/s of HDFC Bank Ltd. (erstwhile HDFC Limited) having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme of Amalgamation approved by Hon'ble NCLT-Mumbai vide order dated 17th March 2023 under Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notices under Section 13 (2) of the said Act, calling upon the following borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) to pay the amounts mentioned against their respective names together with interest thereon at the applicable rates as mentioned in the said notices, within 60 days from the date of the said Notice(s), incidental expenses, costs, charges etc. till the date of payment and / or realisation.

Sr. No.	Name of Borrower(s)/ Legal Heir(s)/ Legal Representative(s)	Outstanding Dues Rs. As on Dt.*	Date of Demand Notice	Date of Possession Physical/ Symbolic	Description of Immovable Property(ies)/ Secured Asset(s)
(a)	(b)	(c)	(d)	(e)	(f)
1	MR. KAMLESH BHIKHABHAI PATEL (Borrower) MRS. PARULBEN KAMLESHBHAIPATEL (Co-Borrower) 153793-656924294 & 653574665	Rs. 2,29,641/- And Rs. 20,98,947/- Respectively as on 31-Mar., 2023*	08-May, 2023	19-March, 2024 Symbolic Possession	UNIT-C-7, ASHVRAD SOCIETY, S. NO. 292/P, RATNAKAR MATA ROAD, KAPADWANJ, ANAND-387620.
2	Wife/Son/ Husband/Daughter of MR. NATVARBHAI MOHANBHAI PARMAR [Since Deceased] And other known and unknown Legal Heir(s), Legal Representative(s), Successors and Assigns of MR. NATVARBHAI MOHANBHAI PARMAR [Since Deceased] (Borrower) MRS. MANJULABEN VIJAYKUMAR PARMAR (Co-Borrower) MR. VIJAYKUMAR NATVARBHAI PARMAR (Co-Borrower) 145410-628164677 & 629107727	Rs. 22,26,925/- And Rs. 93,130/- Respectively as on 30-June, 2022*	05-Aug., 2022	19-March, 2024 Symbolic Possession	DUPLEX-B/5/6/7, PUNIT PARK, S. NO. (R. S. 28 + 29 + 31/P, CS-3710), OPP. SARASHWATI SCHOOL, NR. NARAYAN SOCIETY, DAKOR, KHEDA-388225, GUJARAT.
3	MR. SHUBHAM BHADRESHBHAI KANSARA (Borrower) 168864-667945211 & 668358049	Rs. 27,36,796/- And Rs. 1,36,794/- Respectively as on 30-Nov., 2023*	18-Dec., 2023	19-March, 2024 Symbolic Possession	UNIT-B-26, VIKAS HILLS, S. NO. 136, NEAR PATEL WADI, AT UTTARSANDA, NADIAD, KHEDA-387001.
4	MR. CHANDRAPALSINH PUVAR (Borrower) DR. SHAILENDRASINH PUVAR (Co-Borrower) MRS. KRISHNABEN PUVAR (Co-Borrower) 168260-669620538 & 669620552	Rs. 2,00,901/- And Rs. 17,42,407/- Respectively as on 30-Nov., 2023*	18-Dec., 2023	19-March, 2024 Symbolic Possession	UNIT-12, MANGALAM PARK, R. S. 1303/3/P, NR. MANGAL NAGAR, OPP. VIDHYA DAIRY, BORSAD CROSSING, ANAND-388001.
5	MR. CHANDRAPALSINH PUVAR (Borrower) MRS. MAYURIBEN PUVAR (Co-Borrower) 168259-668153392	Rs. 31,48,419/- as on 30-Nov., 2023*	18-Dec., 2023	19-March, 2024 Symbolic Possession	FLAT-105, 1ST FLOOR, AADITYA RESIDENZA, PLOT-K/261 + 262, S. NO. CS NO.-921, NR. POLYTECHNICA GIRLS HOSTEL, OPP. MUNICIPAL GARDEN, MOTA BAZAAR, VIDHYANAGAR, ANAND-388001.

*with further interest as applicable, incidental expenses, costs, charges etc incurred till the date of payment and / or realisation.

However, since the borrower/s / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove have failed to repay the amounts due, notice is hereby given to the borrower/s / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove in particular and to the public in general that the Authorized Officer of HDFC Bank Limited (erstwhile HDFC Limited) having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme of Amalgamation approved by Hon'ble NCLT-Mumbai vide order dated 17th March 2023) has taken possession of the immovable property (ies) / secured asset(s) described herein above in exercise of powers conferred on him/ them under Section 13 (4) of the said Act read with Rule 8 of the said Rules on the dates mentioned above.

The borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove in particular and the public in general are hereby cautioned not to deal with the aforesaid Immovable Property (ies) / Secured Asset(s) and any dealings with the said Immovable Property (ies) / Secured Asset(s) will be subject to the mortgage of HDFC Bank Ltd.

Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) attention is/are invited to the provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available to redeem the secured asset(s).

Copies of the Panchnama drawn and Inventory made are available with the undersigned, and the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) is/are requested to collect the respective copy from the undersigned on any working day during normal office hours.

Date : 21-03-2024
Place : Vadodara

For, HDFC Bank Ltd.
Sd/-
Authorised Officer

Regd. Office : HDFC Bank Ltd. HDFC Bank House, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai-400013.
CIN : L65920MH1994PLC080618, Website : www.hdfcbank.com

